

B.Com. Semester - 3 (CBCS) Examination
Oct/Nov. -2018
BANKING & FINANCE – 3 (ELECTIVE)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-1	પેમેન્ટ બેંક એટલે શું? તેનાં હેતુઓ અને કામગીરીની ચર્ચા કરો. અથવા	(20)
પ્રશ્ન-1	મૂડી પ્રમાણ માપવાનાં ધોરણો સમજાવો.	
પ્રશ્ન-2	વ્યાપારી બેંકમાં મૂડી ભંડોળ સંચાલન એટલે શું? મૂડી ભંડોળ સંચાલનનાં કાર્યો સમજાવો. અથવા	(20)
પ્રશ્ન-2	રોકડનું સંચાલન એટલે શું? તેનાં કાર્યોની સમજૂતી આપો.	
પ્રશ્ન-3	મુદ્રા બેંક એટલે શું? તેનાં હેતુઓની ચર્ચા કરો. અથવા	(15)
પ્રશ્ન-3	પ્રાથમિક અનામતો એટલે શું? તેનું સ્વરૂપ અને હેતુઓ સમજાવો.	(15)
પ્રશ્ન-4	ટ્રેકનોંધ લખો. (કોઈપણ બે) (૧) ગૌણ અનામતોનું માપન. (૨) ભારતીય મહિલા બેંક. (૩) સ્મોલ બેંક (૪) ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક.	(15)

ENGLISH VERSION

Que-1	What is Payment bank? Discuss its objectives and functions. OR	(20)
Que-1	Explain the method to measure capital Ratio.	
Que-2	What is cash flow management in commercial bank? Explain functions of cash flow management. OR	(20)
Que-2	What is cash management? Explain function of cash management.	
Que-3	What is Mudra bank? Discuss its objectives. OR	(15)
Que-3	What is primary reserves? Describe nature and objectives of primary reserves.	
Que-4	Write short notes. (Any two) (1) Measurement of secondary reserves. (2) Bharti Mahila bank. (3) Small Bank. (4) India Post Payment Bank.	(15)
